

Date: 29-09-2025

To,
The Manager,
National Stock Exchange of India Ltd.
Exchange Plaza, Plot no. C/1, G Block,
Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051.

NSE Symbol: VIAZ **ISIN: INE0MO401019**

Sub: Newspaper Publication- Corrigendum

Ref: Regulation 30 and 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Please find enclosed herewith copies of the newspaper publication published in Free Press and Lokmitra on September 27, 2025, intimating inter-alia about the corrigendum issued for 7th Annual General Meeting of the Company scheduled to be held on **Tuesday, September 30, 2025 at 3:00 p.m.** IST through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

You are requested to take the above disclosure on record.

Thanking you.

Yours faithfully,
For Viaz Tyres Limited

Rajeshkumar Prabhudas Patel
Whole Time Director
DIN: 07883688

REGISTERED OFFICE

VIAZ TYRES LIMITED

(FORMERLY KNOWN AS VIAZ TUBES PRIVATE LIMITED)
915/916, Maple Trade Center, Nr. Surdhara circle,
Sal Hospital Road, Ahmedabad - 380059, Gujarat, India

FACTORY ADDRESS

VIAZ TYRES LIMITED

(FORMERLY KNOWN AS VIAZ TUBES PRIVATE LIMITED)
Plot No. 492, Nandasan Dangarva Road, Nandasan,
Ta: Kadi, Dist: Mehsana - 382705, Gujarat, India

+91 079 4601 6174

info@viaztyres.com

www.viaztyres.com

4.61 inches of rain in 24 hours in Dang

Dang : Continuous heavy rains in Dang district have disrupted normal life. The district headquarters Ahwa has recorded 4.61 inches of rain in the last 24 hours. As a safety measure, the district administration has declared a holiday in all schools. Educational materials have been damaged as rainwater entered the school in Baj village. The road on the bridge near Baj has been washed

away by the water flow. Traffic has been stopped due to falling trees and stones on the Ahwa-Mulchond road. A water crisis has occurred in Pimpri village of Ahwa. The flood of Khapri river has caused financial losses to traders as water has entered the roadside shops. Water is flowing from the bridge on the Khatal-Machli road. Rainwater has also entered Chaktia village.

PM Narendra Modi at WPAC 2025 Opening Ceremony



Ahmedabad, On a historic day for Indian sports, Hon'ble Prime Minister Narendra Modi said hosting the IndianOil New Delhi 2025 World Para Athletics Championships will reiterate India as a "sporting and inclusive" nation to the world. The opening ceremony of the WPAC 2025 was held at the iconic Jawaharlal Nehru Stadium on Thursday evening. In a special message welcoming around 2,200 participants from 100 nations, PM Modi said: "By breaking barriers and setting new benchmarks, para athletes have played a vital role in strengthening India's identity as a rising sporting hub,

motivating millions to embrace sports as a way of life." India is the fourth Asian nation to host the world para athletics championships. The event is being organized by the Paralympics Committee of India. Saying India was "proud" to host the WPAC 2025, PM Modi said: "Sport has a great way of connecting people, transcending all barriers of religion, region and nationality. In today's world, it is all the more important to emphasize this unifying aspect of sport. I am sure the WPAC will have a similar impact on all the participants and spectators."

BSNL to Celebrate Silver Jubilee



Ahmedabad, In a major boost to national communication infrastructure, PM to commission more than 97,500 mobile 4G towers built at a cost of around Rs.37,000 crore with swadeshi technology. In the field of telecom connectivity, the Prime Minister will commission more than 97,500 mobile 4G towers built at a cost of around Rs.37,000 crore with swadeshi technology. This includes more than 92,600 4G technology sites commissioned by BSNL. Over 18,900 4G sites have been funded under the Digital Bharat Nidhi which will connect

around 26,700 unconnected villages in remote, border, and left-wing extremism-affected areas, serving over 2 million new subscribers. These towers are solar-powered, making them India's largest cluster of green telecom sites and a step forward in sustainable infrastructure. The live telecast of the event will be available on the official NIC webcast portal: <https://pmindiawebcast.nic.in> On Silver Jubilee occasion, The press conference was held on 26th September 2025 at BSNL Telephone Bhawan. (19-10)

Young Innovators from Ahmedabad Make History



Ahmedabad, A proud and historic moment for India and Ahmedabad as two bright young minds, Aarna Anshul Shah (Grade 7, Adani International School) and Kyra Moulik Bansal (Grade 7, Anand Niketan International, Sarkhej), secured First Place ?? at the prestigious Asia Pacific Robotics Championship 2025, organized by the World Robot Olympiad (WRO) in the Philippines. In a groundbreaking achievement, Aarna and Kyra became the first-ever all-girls team to represent India at this international stage. With their innovation, creativity, and determination, they outshined top teams from across the Asia Pacific region and brought glory home. This victory is even more remarkable as India has

secured First Place in Robomission Elementary internationally after 10 years- the last win being in 2015. Their achievement marks a new milestone in India's robotics journey and sets the stage for future innovators. Both Aarna and Kyra received their training at The Robotronics Club, Ahmedabad, where their dedication, teamwork, and countless hours of practice translated into this outstanding success. This win not only places them among the brightest young robotic innovators in the world but also serves as an inspiration to girls across the nation, proving that with perseverance and the right guidance, they can lead and excel in the fields of science and technology. (19-10)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLICATION PVT. LTD. and Printed at : Dharti Printers C-3, Shankar Chamber, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLICATION PVT. LTD. 201,202,208 Nandan complex, opp mithakhali rly crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt

How army remains Pakistan's biggest business house



provincial governments and far larger than any private group. The economic value of this land runs into trillions of rupees. More importantly, it gives the army leverage over everything from agriculture policy to urban planning. And this concentration of wealth is not only institutional. It trickles down to the generals themselves. Look at the last three Chiefs of Army Staff, and the picture is telling.

Generals After Retirement General Qamar Javed Bajwa, who served from 2016 to 2022, retired under a storm of asset revelations. In six years, his family's declared wealth reportedly multiplied into billions, spread across properties and businesses at home and abroad. Post-retirement, Bajwa divides his time between Pakistan and overseas residences, a global footprint that reflects the scale of his family's financial rise.

General Raheel Sharif, his predecessor, turned his khaki credentials into a global pay cheque. In 2017, he moved to Riyadh as commander of the Saudi-backed Islamic Military Counter-Terrorism Coalition. His package included a salary and perks that most prime ministers could only dream of. Raheel's retirement is less about fading into private life and more about cashing in on international recognition.

General Ashfaq Parvez Kayani, who ruled the army from 2007 to 2013, chose a quieter domestic retirement but not without wealth. His family's stakes in real estate

the country's celebrated private conglomerates.

Nishat Group, with its banking, textiles, and power plants, brings in around PKR 400 billion annually. Bestway's cement factories and overseas investments hover in the same league. Dawood Hercules and Engro, formidable in energy and fertiliser, remain in the mid-hundreds of billions. Impressive figures, but all fall short of the trillion-rupee juggernaut commanded by khaki.

Pakistan's richest business house is not in Lahore's Gulberg or Karachi's Clifton. It is headquartered in Rawalpindi, behind the gates of General Headquarters. Yet revenue is only part of the story. The army's real treasure is land. And in Pakistan, land is power.

The Business Empire in Uniform

Over decades, the military has accumulated millions of acres through state allocations and welfare schemes. It runs Defence Housing Authorities (DHAs) across major cities, the most coveted brand in Pakistani real estate. From Karachi to Lahore and Islamabad to Multan, DHA plots sell at astronomical premiums. The model is simple: allot land cheaply to officers, then sell at market rates for enormous profits. Generations of generals have built fortunes from these schemes.

Outside the cities, the army has swallowed agricultural land too. In 2024, nearly 4.8 million acres of state land were earmarked for military-run corporate farming. Independent estimates suggest the army now directly or indirectly controls 10 to 12 per cent of Pakistan's land area. That makes it the single largest landholding institution in the country—bigger than

Food safety during Navratri and Dussehra festivals

Rajkot, The ninth day of Navratri has begun in Rajkot, and people are flocking in large numbers to the Garba festivals organized in Rajkot. The Rajkot Health Department is fully equipped to maintain the quality of food items and protect the health of the people during these festivals. Health Officer Dr. Jayesh Vankani said that intensive checking of food items sold at the Navratri venues will be done, so that any kind of adulteration or sale of inedible items can be prevented.


Food license mandatory for organizers According to Dr. Jayesh Vankani, food stalls remain open till late night during festivals like Navratri and Dussehra. Catering arrangements and food stalls are especially made at the Garba venues. All these

organizers have been given clear instructions that they must immediately apply online for a temporary food license. And it is mandatory to follow the rules laid down by FSSAI (Food Safety and Standards Authority of India) and obtaining a license is very important for the organizers. The Health Department team is also providing guidance to the organizers about the online process.

Keeping a close eye on Dussehra sweets and farsan During the last days of Navratri and on the occasion of Dussehra, the popularity of Fafda-Jalebi and various types of sweets increases a lot. These days, sales are also done on a large scale in the market. Keeping this in mind, the Health Department has made a special plan. In future, surveillance sampling will be

conducted on traders and shopkeepers who are involved in the business of Farsan and sweets. He said that the main objective of this action is to prevent the sale of inedible sweets. Thorough inspection of cleanliness and quality

Health department teams will visit Garba venues and check not only the licenses but also the quality and cleanliness of the food items. This inspection will focus on hygiene as well as quality and packaging. Hygiene: Whether the employees preparing and serving food maintain adequate hygiene. Quality: Whether the quality of the ingredients and components used in the food items is appropriate. Packaging: If the food items are packaged, whether the packaging regulations have been followed or not.



SMFG India Home Finance Co. Ltd.
Corporate Off.: 503 & 504, 5th Floor, G-Block, Inspire BKC, BKC Main Road, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400051.
Regd. Off.: Commerzone IT Park, Tower B, 1st Floor, No. 111, Mount Poonamallee Road, Porur, Chennai - 600116, TN.

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES


E-AUCTION SALE NOTICE OF 30 DAYS FOR SALE OF IMMOVABLE ASSETS UNDER THE SECURITISATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISION TO RULE 8(6) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002.
Notice is hereby given to the Public in General and in particular to the Borrower(s) and Guarantor(s) that the below listed immovable properties ("Secured Assets") mortgaged / charged to the Secured Creditor, the Possession of which has been taken by the Authorised Officer of SMFG India Home Finance Co. Ltd. (hereinafter referred to as SMHFC) ("Secured Creditor"), will be sold on "As is where is", "As is what is" and "Whatever there is" on the date and time mentioned herein below, for recovery of the dues mentioned herein below and further interest and other expenses thereon till date of realization, due to SMHFC Secured Creditor from the Borrower(s) and Guarantor(s) mentioned herein below.

Sr. No.	Name of the Borrower(s) / Guarantor(s) LAN	Description of the Properties	Reserve Price : Earnest Money Deposit :	Date & Time of E-Auction	Date of EMD Submission
1.	Lan No. - 600439211668230 1. Venkatesan Rajangan 2. Sasikala Venkatesan	In The District And Sub District Jamnagar At Village Dhinchada Land Bearing R.S. No. 37/Paiki 3. Have Converted Into Non Agricultural Land Divided Into Plot No.1to 323 Residential Plots Known As " Tirupati Park 2" Out Of This Plots Of Tirupati Part- 2 Plot Number 299 And 300 Were Amalgamated And Given New Plot Number 299, New Plot No.299 Was Sub Plotted And Divided Into 3 Sub Plots Of This Sub Plot No.299/3 Admeasuring Plot Area 85.28 Sq. mtrs Together With Construction Bounded as East: 7.50 Mtr Wide Road Is Situated, West: Plot No. 315 Is Situated, North: Plot No.301 Is Situated, South : Sub Plot No.299/2 Is Situated	Rs. 25,00,000/-	04.11.2025 at 11.00 AM to 01.00 PM	03.11.2025
			Rs. 2,50,000/-		
2.	Lan No. - 600239211017101 1. Ratilal Ravijibhai Kachhadia 2. Geetaben Ratilal Kachhadia	The Property Bearing A-Type, Plot No.60 Admeasuring 42.42 Sq.mts Along With 26.75 Sq.mts Undivided Share In The Land Of Road & C.o.p. Total Admeasuring 69.17 Sq.mts In " Shree Kalyan Residency" Situated At Block No.167, Survey No.172 Admeasuring 12962.00 Sq.mts Of Moje Village Kamrej Tal: Kamrej Surat Bounded As East: Plot No. A-61, West: Plot No. A-59, North : Plot No.A-45, South: Society Road	Rs. 12,00,000/-	04.11.2025 at 11.00 AM to 01.00 PM	03.11.2025
			Rs. 1,20,000/-		

Details terms and conditions of the sale are as below and the details are also provided in our/secured creditor's website at the following link website address (<https://BidDeal.in> and <https://www.grihashakti.com/pdf/E-Auction.pdf>) The Intending Bidders can also contact : **Abhishek Awasthi**, on his Mob. No. 9825097367, E-mail : **Abhishek.Awasthi@grihashakti.com**, and **Mr. Niloy Dey**, on his Mob. 9820697801, E-mail : **Niloy.Dey@grihashakti.com**

Place : Jamnagar, Surat, Gujarat
Date : 24.09.2025 / 26.09.2025

Sd/-
Authorized Officer,
SMFG INDIA HOME FINANCE CO. LTD.



ICICI Bank


Branch Office: ICICI Bank Ltd Office Number 201-B, 2nd Floor, Road No. 1 Plot No-B3, WIFI IT Park, Wagle Industrial Estate, Thane (West)- 400604

The Authorised ICICI Bank Officer under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued Demand Notices to the borrower(s) mentioned below, to repay the amount mentioned in the Notice within 60 days from the date of receipt of the said Notice.
Having failed to repay the amount, the Notice is issued to the borrower and the public in general that the undersigned has taken symbolic possession of the property described below, by exercising powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property. Any dealings with the property will be subject to charges of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower(s)/ Loan Account Number	Description of Property/ Date of Symbolic Possession	Date of Demand Notice/ Amount in Demand (Rs)	Name of Branch
1.	Patel Kiran Ishwarbhai & Patel Suraj Ishwarbhai & Patel Parvatiben Ishvar- LBSUR00005617649	Nondh No. 814, Behind Nani Bahucharaji Temple, Near Prannath Hospital, Ved Road, Tunki, Surat- 395004/ September 22, 2025	April 24, 2025 Rs. 29,76,259.98/-	Surat
2.	Bhagvanbhai Mohanbhai Gondaliya & Kailasben Bhagavanbhai Gondaliya - LBSUR00004971039 & LBSUR00004971038	Plot No-48, Balkrushna Row House, Near Marutidhan Soc, Rangoli Chowkdi, R.S. No-166, 172/2, Block No-165, (after K.J.P New Block No-165-48) Taluka-Olpad, Village-umra, Surat- 395007./ September 22, 2025	April 12, 2025 Rs. 9,74,573/-	Surat

The above-mentioned borrowers(s)/guarantors(s) is/are hereby issued a 30 day Notice to repay the amount, else the mortgaged properties will be sold after 30 days from the date of publishing this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.
Date: September 26, 2025
Place: Surat

Sincerely Authorised Officer,
For ICICI Bank Ltd.



VIAZ TYRES LIMITED

CIN: L25198GJ2018PLC103740
Registered Office: 915/916 Maple Trade, Nr. Surchara Circle, Sal Hospital Road, Thaltej, Ahmedabad, Gujarat, India, 380059
Email: cs@viaztyres.com Website: www.viaztyres.com Contract: +91-7946016174

CORRIGENDUM TO THE NOTICE OF 7TH ANNUAL GENERAL MEETING

This is with reference to the Notice of the 7th Annual General Meeting ("AGM") of the members of Viaz Tyres Limited ("the Company"), scheduled to be held on 30th September 2025 at 03:00 p.m. through Video Conferencing ("VC") "Other Audio-Visual Means ("OAVM"). E-voting in respect of the resolutions set out in the Notice is scheduled to commence on Saturday, 27th September 2025 at 9:00 A.M. and ends on Monday, 29th September, 2025 at 5:00 P.M. The said AGM and e-voting are being conducted in accordance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act"), read with the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standard-2 (SS-2) on General Meetings, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and other applicable laws, regulations, and amendments thereof.
The Board of Directors, at their meeting held on 25th September 2025 considered and approved the following:
1. The Board took note of the recommendations received from the Stock Exchange and accordingly approved the necessary additions/ modifications to the Notice of the 7th Annual General Meeting.
2. The Board also approved Corrigendum No. 01 to the Notice of the 7th Annual General Meeting of the members of the Company.
The corrigendum has been issued to incorporate / add / modify certain disclosures / information in the AGM Notice and Explanatory Statement thereto, as required under applicable laws.
Please note that all other particulars of the proposed issue, including the issue size, issue price, maximum number of warrants to be issued, and other terms and conditions remain unchanged.
This corrigendum is being issued to inform the members of the Company about the alterations/modifications made to the Explanatory Statement of item number 6&7 of the resolution as set forth in the AGM notice. The revised details are set out below for your consideration as below. This corrigendum should be read in continuation of and in conjunction with the notice. The Corrigendum to the notice is also being placed on Company's website <https://www.viaztyres.com/investor>.

EXPLANATORY STATEMENT PURSUANT TO SECTION 102(1) OF THE COMPANIES ACT, 2013
Item No. 6 & 7:
Addition in point 14:
Proposed time frame within which the issue or allotment shall be completed
Pursuant to the requirements of SEBI (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, the Company shall complete the allotment of equity shares of the Company to the proposed allottees on or before the expiry of 15 days (fifteen days) from the date of passing of Special Resolution by the members of the Company. Provided that where the issue and allotment of the shares is pending on account of any approval or permission for such issue and allotment by any regulatory authority, the issue and allotment shall be completed within a period of 15 (fifteen) days from the date of receipt of last of such approvals or permissions. The Warrants may be exercised by the Warrant holder, in one or more tranches, at any time on or before the expiry of 18 months from the date of allotment of the Warrants by issuing a written notice to the Company specifying the number of Warrants proposed to be exercised along with the aggregate amount payable thereon. The Company shall accordingly, without any further approval from the shareholders of the Company, allot the corresponding number of Equity Shares in dematerialized form. Upon exercise of the option by the allottee to convert the warrants in to Equity Shares, the Company shall ensure that the allotment of Equity Shares pursuant to exercise of the warrants is completed within 15 days from the date of such exercise by the allottee.
Modification/ Addition in point 20:
The percentage (%) of Post Preferential Issue Capital that may be held by the allottees and change in control, if any, consequent to the Preferential Issue:
The percentage (%) of Post Preferential Issue Capital that may be held by the allottees as mentioned in table below and there shall be no change in the management or control of the Company pursuant to the aforesaid issue and allotment of Equity Shares and Convertible Warrants.

Sr. No.	Name	Current & Proposed Status / Category	Pre Issue Shareholding		No. of Equity Shares to be allotted	No. of Warrants to be allotted	*Post Issue Shareholding	
			No. of share	%			No. of share	% of the post Capital
1.	Ritesh Praveen Kothari	Non-Promoter	0	0	2,00,000	0	2,00,000	0.97
2.	Burgeon Holding Private Limited	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24
3.	Shivani Arvindkumar Mehta	Non-Promoter	0	0	24,000	0	24,000	0.12
4.	Nikhil Santosh Oswal	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13
5.	Murlihar Fintech	Non-Promoter	0	0	24,000	0	24,000	0.12
6.	Swati Jain	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13
7.	Nilaaben Kamleshkumar Shah	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13
8.	Smit Patel	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24
9.	Amishi Paras Mehta	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15
10.	Paras Rohit Mehta	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15
11.	Kawarfa Dugar	Non-Promoter	0	0	1,04,000	0	1,04,000	0.50
12.	Shruti Kapoor	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15
13.	Pooja Rahul Shah	Non-Promoter	0	0	1,50,000	0	1,50,000	0.72
14.	Rupani Devendrakumar Trikambhai	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24
15.	Ashish Goswami	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24
16.	Aruna Goswami	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24
17.	Pranav Chandravadan Shah	Non-Promoter	0	0	18,000	0	18,000	0.09
18.	Rimaben Pranav Shah	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15
19.	ProEx Advisors LLP	Non-Promoter	0	0	5,24,000	0	5,24,000	2.53
21.	Janakkumar Mahendrabhai Patel	Promoter	26,96,100	22.01	0	24,45,000	51,41,100	24.85
22.	Rajesh Prabhudas Patel	Promoter	13,25,250	10.82	0	4,11,000	17,36,250	8.39
23.	Parichaykumar Maganlal Patel	Promoter	9,18,650	7.5	0	1,00,000	10,18,650	4.92
24.	Kenaben Parichaykumar Patel	Promoter	8,37,900	6.84	0	1,50,000	9,87,900	4.77
25.	Nimaben Rajeshkumar Patel	Promoter	30,400	0.25	0	3,55,000	3,85,400	1.86
26.	Amil Nandlal Thummar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
27.	Aakash Nandlal Thummar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
28.	Alpesh Manubhai Jiyani	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
29.	Narantaben Narendrakumar Sachani	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
30.	Kathirya Vimalkumar Parshotambhai	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
31.	Kathirya Nilkumar Vimalkumar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76
32.	Mukundbhai Jagdishchandra Patel	Non-Promoter	0	0	0	50,000	50,000	0.24
Total			58,08,300	47.42	15,00,000	69,40,000	1,42,48,300	68.86

*** The post preferential issue shareholding as shown above is calculated assuming full exercise of Warrants and consequential allotment of the Equity Shares of the company.**
Correction of typo error in Resolution 7:
In Resolution 7, the No. of Warrants for allottee no. 12 - Mukundbhai Jagdishchandra Patel to be read and considered as '50,000' instead of 5,71,500.

PLEASE NOTE:
THIS CORRIGENDUM TO THE AGM NOTICE SHALL FORM AN INTEGRAL PART OF THE AGM NOTICE, WHICH HAS ALREADY BEEN CIRCULATED TO THE SHAREHOLDERS OF THE COMPANY AND ON AND FROM THE DATE HEREOF, THE AGM NOTICE SHALL ALWAYS BE READ IN CONJUNCTION WITH THIS CORRIGENDUM.
All other contents of the notice remain unchanged.

For Viaz Tyres Limited
s/-
Hema Advani
Company Secretary

Date: 26/09/2025
Place: Ahmedabad

નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી – આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ તા. ૨૨ સપ્ટેમ્બરે PMJAY યોજનાને ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યમાં “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ

ગાંધીનગર એચ.ઓ

આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીશ્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને ૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(૨- કેટેગરી)” નો શુભારંભ થયો છે. જેના પગલે રાજ્યના ૬.૪૨ લાખ જેટલા અધિકારી-કર્મચારી અને પેન્શનર્સને આ યોજના હેઠળ રૂ. ૧૦ લાખની કેશલેસ સારવારનો લાભ મળશે. આ યોજના માટે રાજ્ય સરકારને વાર્ષિક રૂ. ૩૦૩.૫ કરોડની જન ધરણ – અત્રે નોધનીય છે કે, વર્ષ ૨૦૧૯ થી વર્ષ ૨૦૨૫ સુધીમાં કુલ ૨.૯૨ લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. જેમાં કુલ ૧૫.૨૭ લાખ દાવાઓ માટે કુલ રૂ. ૧૩,૮૯૪.૫૩ કરોડની કલેઈમ ચૂકવણી કરવામાં આવી છે.

હાલ રાજ્યમાં આ યોજના અંતર્ગત કુલ ૨૭૦૮ હોસ્પિટલ (જેમાં ૯૪૩ – ખાનગી , ૧૭૬૫ – સરકારી) એમ્બેન્ડ છે.જેમાં ૨૪૭૧ પ્રોસિડરનો લાભ અપાય છે.

આ યોજના હેઠળની માહિતી મેળવવા કે ફરિયાદ નિવારણ માટે ૦૭૯-૬૬૪૪૦૧૦૪ હેલ્પલાઈન નંબર પણ કાર્યરત કરાયો છે. તત્કાલીન

અરિહંત એકેડેમીએ અમદાવાદમાં નવા કોથિંગ સેન્ટર સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો

અમદાવાદ, શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં ૨૭ વર્ષના અનુભવ સાથે મુંબઈમાં ટોચની કોથિંગ ઈન્સ્ટિટ્યૂટ અરિહંત એકેડેમીએ અમદાવાદમાં દાયકાથી વધારે સમયગાળાનો અનુભવ ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા ધ નોલેજ એકેડેમી (TKA), અમદાવાદ સાથે સમજૂતીકરાર (MoU) કર્યા છે. આ જેાણ સાથે અરિહંત ગુજરાતમાં તેની અસરકારક કે પુરવાર થયેલી શૈક્ષણિક પદ્ધતિનો લાભ વિદ્યાર્થીઓને અપશે. સંસ્થા IIT-JEE, NEET (UG), GUJ-CET સહિત વિવિધ પ્રોગ્રામ તેમજ NTSE, ઓલીમ્પિયાડ્સ વગેરે જેવા ફાઉન્ડેશન કોર્સમાં પોતાની અસરકારક કુશળતા પ્રદાન કરશે. આ નવું કેન્દ્ર અમદાવાદમાં સાઉથ બોપલમાં સફળ પરિસરની સામે ઓર્થિડ સેન્ટરમાં સ્થિત છે, જે ૬૦૦થી વધારે વિદ્યાર્થીઓને સેવા આપવાની ક્ષમતા

સાયન્સ સફર: વિજ્ઞાન સાથેનું અનુભવજન્ય શિક્ષણ ગુજરાત સાયન્સ સિટીમાં



અમદાવાદ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે સતત કાર્યરત છે. જેના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિજ્ઞાન વિષયક કાર્યક્રમોનો આયોજન કરવામાં આવતું રહે છે. ગુજરાત સાયન્સ સિટીના – એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક સહિતના સાયન્સ સીટીના વિવિધ આકર્ષણો આવેલા છે. ગુજરાત સાયન્સ સિટીમાં દરરોજ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ સહીત મોટી સંખ્યા માં મુલાકાતો આવે છે. તેઓની આ મુલાકાત ને ‘સાયન્સ સફર’ બનાવવા શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને જુદા વર્કશોપ્સ વડે



મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે વર્ષ ૨૦૧૨ માં રૂ. ૩૦ કરોડની બજેટ જોગવાઈ થી શરૂ થયેલ મા યોજના વર્ષ ૨૦૧૪ માં મા –વાસ્તવ્ય યોજનામાં પરિણમી હતી. જેમાં વર્ષ ૨૦૧૨ થી વર્ષ ૨૦૧૮ સુધીમાં રૂ. ૧૧૭૯.૧૯ કરોડના કલેઈમ ચૂકવણી કરાઈ હતી. ૧૦૮ એમ્બુલન્સ વિષે ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં વધારો કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૯૪ નવી ૧૦૮ એમ્બુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.

૧૦૮ સેવા હેઠળ આ યોજનાના વિશ્વસનિયતા અને તેની કાર્યક્ષમતાના કારણે નાગરીકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. આ સેવાને વધુ સુદૃઢ અને ઝડપી બનાવવા આજે વધુ ૯૪ નવી ૧૦૮ એમ્બુલન્સને નાગરિકોની સ્વાસ્થ્ય સેવામાં કાર્યરત કરવામાં આવી છે. શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં ૧૦૮ ઈમરજન્સી સેવા હેઠળ

ગરીબ - મધ્યમવર્ગીય પરિવારોના ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પરિવારોને વિનામૂલ્યે પ્લોટની ફાળવણી કરાઈ

ગાંધીનગર એચ.ઓ ઘરનું ઘર હોવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. પરંતુ ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ સપનું માત્ર એક સ્વપ્ન બની રહે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદનશીલ વહીવટ અંતર્ગત ઘર વિહોણા પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા પામતળ નીમ કરવા તથા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટ ફાળવવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

આ યોજના હેઠળ એક જ દિવસમાં અમદાવાદના દસકોઈ તાલુકાના ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપીને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલી યોજનાનો મુખ્ય હેતુ પ્રતિસાદ પૂરો પાડી શકાય તે માટે વિહોણા કુટુંબોને પોતાનું ઘર બનાવવા માટે ૧૦૦ ચોરસ વારના પ્લોટ વિનામૂલ્યે આપવાનો છે. આ યોજના હેઠળ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્લોટ ફાળવવાની રૂબેશ તા. ૨ સપ્ટેમ્બરથી હાથ ધરવામાં આવી હતી. આ રૂબેશના મંત્રીશ્રીએ ૧૦૮ સેવાની કાર્યક્ષમતા બતાવણી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫એ દસ્ક્રોઈ તાલુકાના ઓડ ગામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓડ ગામના ૪૧ પ્લોટ વિહોણા

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન” ના બેચરાજ ખાતેના કાર્યક્રમમાં લોકસભા સાંસદશ્રીના હસ્તે ટીબીના દર્દીઓને નિક્ષેય કીટનું વિતરણ કરવામાં આવ્યું



મહેસાણા જિલ્લા ક્ષય અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” અંતર્ગત વર્ષ-૨૦૨૫ સુધીમાં ભારત દેશને ટીબીથી મુક્ત કરવા અંગેના માન.વડાપ્રધાનશ્રીના ધ્યેય અંતર્ગત સ્વૈચ્છીક સંસ્થાઓ/દાતાઓ દ્વારા ટીબીની સારવાર હેઠળના દર્દીઓને દત્તક લઈ તેઓને માસિક પોષણ કીટ આપવામાં આવે છે.

આજરોજ વડાપ્રધાનશ્રીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે ભારત સરકારશ્રી દ્વારા આરંભ કરવામાં આવેલ “સ્વસ્થ નારી, સશક્ત

પરિવાર અભિયાન” ના બેચરાજ ખાતેના કાર્યક્રમમાં લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલના હસ્તે બેચરાજના દાતા દ્વારા દત્તક લેવાયેલ ટીબીના દર્દીઓને નિક્ષેય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા ઓએનજસીના CSR ફંડ દ્વારા કોહેઝન ટ્રસ્ટ થકી કુલ ૩૩૦ દર્દીઓને આજરોજ દત્તક લેવામાં આવેલ છે. કડી તાલુકામાં ઝઈઈછ સીરામીક કંપનિ દ્વારા કુલ-૧૦૦ દર્દીઓને, જોટાણ તાલુકામાં કંપ્લીધર પ્રા.લી. દ્વારા કુલ ૫૦ દર્દીઓને તથા ૧૧ પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ દ્વારા કુલ ૧૬ દર્દીઓને, વિજાપુર

લાભાર્થીઓને સ્થળ પર જ પ્લોટ ફાળવણી હુકમ, પ્લોટની સનદ અને કબજા પાવતી (હક) આપવામાં આવી છે. ગ્રામ પંચાયતથી મહેસૂલ વિભાગ સુધી માત્ર ૧૫ દિવસના ટૂંકા સમયગાળામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને જરૂરીયાતમંદોને પ્લોટ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લાભાર્થીઓને આ પ્લોટના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત સરકારની આ જનકલ્યાણકારી યોજનાની પ્રશંસા કરી જણાવ્યું હતું કે, અમારી સરકારનો મુખ્ય હેત્ય દરેક નાગરિકને પાયાની સુવિધાઓ પૂરી પાડવાનો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "સૌને આવાસ"ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ યોજના એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહી છે. ઓડ ગામના આ ૪૧ પરિવારો માટે આ પ્લોટ માત્ર જમીનનો ટુકડો નથી, પરંતુ તે તેમના ભવિષ્યનો આધાર છે. હવે તેઓ પોતાના સપનાનું ઘર બનાવી ગૌરવભેર જીવન જીવી શકશે. આ યોજનાએ દર્શાવ્યું છે કે ગુજરાત સરકાર માત્ર કાયદાઓ અને નિયમોનું પાલન પ્રત્યે જ નહીં પરંતુ નાગરિકોની જરૂરિયાતો પ્રત્યે પણ તેટલી જ સંવેદનશીલ છે. રાજ્ય સરકાર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સન્માનભેર જીવન જીવવાની તક આપી અન્ય રાજ્યો માટે સાચા સુશાસનનું ઉદાહરણ બની રહી છે.

મહેસાણા જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દ્વારા વડાપ્રધાનએ સહકાર ક્ષેત્રની યોજનાઓ અને કલ્યાણલક્ષી નિર્ણયો બદલ ‘પોસ્ટકાર્ડ’ મારફતે જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી

મહેસાણા જિલ્લામાં તા. ૧૭/૦૮/૨૦૨૫ના રોજ ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિન નિમિત્તે મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાની સહકારી મંડળીઓના હોદ્દાદારો, સભ્યો, ખેડૂતો/પશુપાલકો દ્વારા વડાપ્રધાનશ્રી પ્રત્યેની તેમની સ્નેહભરી લાગણીને વ્યક્ત કરવા વિશાળ સંખ્યામાં પોસ્ટકાર્ડ મોકલી અને “સરકારશ્રી દ્વારા સહકાર ક્ષેત્રે કરેલ કામગીરી માટે આભાર વ્યક્ત કરી જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભારતીય

સંસ્કૃતિ અને પરંપરા મુજબ ગામમાં તથા મંડળીએ ભેગા બળીને વડાપ્રધાનશ્રી પ્રત્યેની લાગણીના ઓવારણા લઈ મૌખિક સ્વરૂપે પણ તેમની લાગણી રજૂ કરેલ હતી. શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ પોસ્ટકાર્ડમાં વડાપ્રધાનશ્રીને આભાર વ્યક્ત કરતી કેટલીક બાબતો જેવી કે, ‘ભારત સરકારશ્રી દ્વારા જાહેર કરેલ સહકારનીતિ ૨.૦’, ‘સહકાર ક્ષેત્રે મહિલાઓના યોગદાનનું વધારો તથા મહિલાની આવક-સ્રોતમાં વધારો કરી મહિલા સશક્તિકરણ માટેના સરકારશ્રીના પ્રયાસો’, ‘હાલમાં

અમેરિકાની ડેરી પ્રોડક્ટનો ભારતમાં પ્રવેશ અટકાવ કરી સરકારશ્રી દ્વારા ધ્યાનમાં લીધેલ અસંખ્ય ખેડૂતોનું હિત’, ‘સેવા સહકારી મંડળીઓને સશક્ત કરવા સરકારશ્રી દ્વારા જાહેર કરેલી યોજનાઓ અને પહેલો’, ‘ખેડૂતોની કમાણી બમણી થાય તે માટે સરકારશ્રી દ્વારા કરેલા યશસ્વ પ્રયત્નો’, ‘ CO-operation amongst coop-eratives દ્વારા તમામ સહકારી સંસ્થાઓ એકબીજાના સહયોગથી મજબુત થાય તે માટે સરકારશ્રીના પ્રયત્નો’ વગેરે કેન્દ્રસ્થાને હતી.

સાંકેતિક કબજા નોટીસ				
<p>શાખાનું સરનામું : આઈસીઆઈસીઆઈ બેંક લિ., ઓહીયો નં.૨૦૧-૧બી, બીજો માળ, રોડ નં.૧, પ્લોટ નં.બી૩, વાઈફાઈ આઈડી પાર્ક, વાગલે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, થાણે (વેસ્ટ) -૪૦૦૬૦૪.</p>				
<p>આખી સિક્યુરિટીઠાઈડેશન ફિક્ડફરક્શન ફાઈનાન્સ એસેટ એન્ડ એનફોર્સમેન્ટ એન્ડ સિક્યુરિટી એન્ડ ઈન્ટરેસ્ટ એન્ડ, ૨૦૦૨ અને સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ ૨૦૦૨ની કલમ ૧૩ (૧૨) તેની સાથે અનુચ્છેદ ૩ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ અહી નીચે સહી કરનાર આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડના સત્તાધાર અધિકારીએ નીચે જણાવેલ લોકોને માંગણા નોટીસ આપી છે. આ નોટીસ આપવાથી ૬૦ દિવસની અંદર આઈ દર્શાવેલા નાણા ભરી જવા જણાવવામાં આવે છે. કરજદારો નાણા ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. આથી કરજદારો અને સામાન્ય જનતાની જાણ માટે નીચે જણાવેલા અધિકૃત અધિકારીએ અહી જણાવેલી મિલકતને સાંકેતિક કબ્જે લીધો છે જે કલમ ૧૩ (૪) અનુચ્છેદ ૮ સાથે વાંચતા મળેલી સત્તાની રૂએ કાયંવાલી કરી છે. કરજદારો અને સામાન્ય જનતાના આથી ચેતવણી આપવામાં આવે છે કે આઈસીઆઈસીઆઈ બેંક લીમીટેડ પાસે આ મિલકત ટાંચમાં હોય કરજદારોએ અને સામાન્ય જનતાએ ટાંચમાં લીધેલ મિલકત સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં.</p>				
ક્રમ નં.	દેવાદારોનું નામ / લેાનોનો ખાતા નંબર	મિલકતોની વિગતો / સાંકેતિક કબજાની તારીખ	દિનનું એકીકૃત નકલ / વિનય નેવિકલ્પક દલા(રૂ)	શાખાનું નામ
૧	પટેલ કિરણ ઈશ્વરભાઈ અને પટેલ સુરજ ઈશ્વરભાઈ અને પટેલ ધાવતીબેન ઈશ્વર / LBSUR00005617649	નોંધ નં.૮૧૪, નાની બહુચરાજ મંદિર પાછળ, પ્રણામ હોસ્પિટલ પાસે, વેદ રોડ, તુમકી, સુરત ૩૮૫૦૦૪. / સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૫	એપ્રિલ ૨૪, ૨૦૨૫ ર૯,૭૬,૨૫૯.૮૮/-	સુરત
૨	ભગવાનભાઈ મોહનભાઈ ચૌહાણ અને કેલસભન ભગવાનભાઈ ચૌહાણ / LBSUR00004971039 & LBSUR00004971038	પ્લોટ નં.૪૮, બાલકૃષ્ણા રો-હાઉસ, માટુડીના સોસાયટી પાસે, રંચોલી ચોકડી, આર.એસ.નં.૧૬૬, ૧૭૨/૨, બ્લોક નં.૧૬૫ (કે.જે.પી.પ્લોટ નવા બ્લોક નં.૧૬૫-૪૮), તાલુકા-ઓલધા, ગામ-ઈમરા, સુરત-૩૮૫૦૦૭. / સપ્ટેમ્બર ૨૨, ૨૦૨૫	એપ્રિલ ૧૨, ૨૦૨૫ રૂ. ૯,૭૪,૫૭૩.૦૦/-	સુરત

ઉપર જણાવેલા કરજદાર(રો)અહી બધાર(રો)અહી બધા પૈરાં પરત કરવામાં નહીં આવે તો સિક્યુરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની કલમ ૮ અને ૯ નીજોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલકતે આ નોટીસ પ્રસિદ્ધ થવામાં ૩૦ દિવસ બાદ વેચી દેવામાં આવશે.

તારીખ : સપ્ટેમ્બર ૨૬, ૨૦૨૫

સ્થળ : સુરત

VIAZ

TYRES LIMITED

CIN: L25198GJ2018PLC103740

Registered Office: 915/916 Maple Trade, Nr. Surdhara Circle, Sai Hospital Road, Thaltej, Ahmedabad, Gujarat, India, 380059

Email: cs@viaztyres.com Website: www.viaztyres.com Contract: +91-7946016174

CORRIGENDUM TO THE NOTICE OF 7TH ANNUAL GENERAL MEETING

This is with reference to the Notice of the 7th Annual General Meeting ("AGM") of the members of Viaz Tyres Limited ("the Company"), scheduled to be held on 30th September 2025 at 03:00 p.m. through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"). E-voting in respect of the resolutions set out in the Notice is scheduled to commence on Saturday, 27th September 2025 at 9:00 A.M. and ends on Monday, 29th September, 2025 at 5:00 P.M. The said AGM and e-voting are being conducted in accordance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act"), read with the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standard-2 (SS-2) on General Meetings, SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, and other applicable laws, regulations, and amendments thereto.

The Board of Directors, at their meeting held on 25th September 2025 considered and approved the following:

- The Board took note of the recommendations received from the Stock Exchange and accordingly approved the necessary additions/ modifications to the Notice of the 7th Annual General Meeting.
- The Board also approved Corrigendum No. 01 to the Notice of the 7th Annual General Meeting of the members of the Company.

The corrigendum has been issued to incorporate / add / modify certain disclosures / information in the AGM Notice and Explanatory Statement thereto, as required under applicable laws.

Please note that all other particulars of the proposed issue, including the issue size, issue price, maximum number of warrants to be issued, and other terms and conditions remain unchanged.

This corrigendum is being issued to inform the members of the Company about the alterations/modifications made to the Explanatory Statement of Item number 6&7 of the resolution as set forth in the AGM notice. The revised details are set out below for your consideration as below. This corrigendum should be read in continuation of and in conjunction with the notice. The Corrigendum to the notice is also being placed on Company's website <https://www.viaztyres.com/investor>.

EXPLANATORY STATEMENT PURSUANT TO SECTION 102(1) OF THE COMPANIES ACT, 2013

Item No. 6 & 7:

Addition in point 14:

Proposed time frame within which the issue or allotment shall be completed

Pursuant to the requirements of SEBI (Issue of Capital and Disclosure Requirements) Regulations, 2018, the Company shall complete the allotment of equity shares of the Company to the proposed allottees on or before the expiry of 15 days (fifteen days) from the date of passing of Special Resolution by the members of the Company. Provided that where the issue and allotment of the shares is pending on account of any approval or permission for such issue and allotment by any regulatory authority, the issue and allotment shall be completed within a period of 15 (fifteen) days from the date of receipt of last of such approvals or permissions. The Warrants may be exercised by the Warrant holder, in one or more tranches, at any time on or before the expiry of 18 months from the date of allotment of the Warrants by issuing a written notice to the Company specifying the number of Warrants proposed to be exercised along with the aggregate amount payable thereon. The Company shall accordingly, without any further approval from the shareholders of the Company, allot the corresponding number of Equity Shares in dematerialized form. Upon exercise of the option by the allottee to convert the warrants in to Equity Shares, the Company shall ensure that the allotment of Equity Shares pursuant to exercise of the warrants is completed within 15 days from the date of such exercise by the allottee.

Modification (Addition in point 20:

The percentage (%) of Post Preferential Issue Capital that may be held by the allottees and change in control, if any, consequent to the Preferential Issue:

The percentage (%) of Post Preferential Issue Capital that may be held by the allottees as mentioned in table below and there shall be no change in the management or control of the Company pursuant to the aforesaid issue and allotment of Equity Shares and Convertible Warrants.

Sr. No.	Name	Current & Proposed Status / Category	Pre Issue Shareholding		No. of Equity Shares to be allotted	No. of Warrants to be allotted	Post Issue Shareholding		
			No. of share	%			No. of share	% of the post Capital	
1.	Ritesh Praveen Kothari	Non-Promoter	0	0	2,00,000	0	2,00,000	0.97	
2	Burgeon Holding Private Limited	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24	
3.	Shivani Arvindkumar Mehta	Non-Promoter	0	0	24,000	0	24,000	0.12	
4.	Nikhil Santosh Oswal	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13	
5.	Murliidhar Fintech	Non-Promoter	0	0	24,000	0	24,000	0.12	
6.	Swati Jain	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13	
7.	Nilaben Kamleshkumar Shah	Non-Promoter	0	0	26,000	0	26,000	0.13	
8.	Smil Patel	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24	
9.	Amishi Paras Mehta	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15	
10.	Paras Rohit Mehta	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15	
11.	Kawarali Dugar	Non-Promoter	0	0	1,04,000	0	1,04,000	0.50	
12.	Shruti Kapoor	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15	
13.	Pooja Rahul Shah	Non-Promoter	0	0	1,50,000	0	1,50,000	0.72	
14.	Rupani Devendrakumar Trikambhai	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24	
16.	Ashish Goswami	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24	
17.	Aruna Goswami	Non-Promoter	0	0	50,000	0	50,000	0.24	
18.	Pranav Chandravadan Shah	Non-Promoter	0	0	18,000	0	18,000	0.09	
19.	Rimaben Pranav Shah	Non-Promoter	0	0	32,000	0	32,000	0.15	
20	ProEx Advisors LLP	Non-Promoter	0	0	5,24,000	0	5,24,000	2.53	
21	Janakkumar Mahendrabhai Patel	Promoter	26,96,100	22.01	0	24,45,000	51,41,100	24.85	
22	Rajesh Prabhadus Patel	Promoter	13,25,250	10.82	0	4,11,000	17,36,250	8.39	
23	Parichaykumar Maganlal Patel	Promoter	9,18,650	7.5	0	1,00,000	10,18,650	4.92	
24	Kenaben Parichaykumar Patel	Promoter	8,37,900	6.84	0	1,50,000	9,87,900	4.77	
25	Nimaben Rajeshkumar Patel	Promoter	30,400	0.25	0	3,55,000	3,85,400	1.86	
26	Amit Nandlal Thummar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
27	Aakash Nandlal Thummar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
28	Alpesh Manubhai Jyani	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
29	Namrataben Narendrakumar Sachani	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
30	Kathiriya Vimalkumar Parshotambhai	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
31	Kathiriya Nikumar Vimalkumar	Non-Promoter	0	0	0	5,71,500	5,71,500	2.76	
32	Mukundbhai Jagdishchandra Patel	Non-Promoter	0	0	0	50,000	50,000	0.24	
Total			58,08,300	47.42	15,00,000	69,40,000	1,42,48,300	68.86	

The post preferential issue shareholding as shown above is calculated assuming full exercise of Warrants and consequential allotment of the Equity Shares of the company.

Correction of typo error in Resolution 7:

In Resolution 7 the 'No. of Warrants' for allottee no. 12 - Mukundbhai Jagdishchandra Patel to be read and considered as '50,000' instead of 5,71,500.

PLEASE NOTE:

THIS CORRIGENDUM TO THE AGM NOTICE SHALL FORM AN INTEGRAL PART OF THE AGM NOTICE, WHICH HAS ALREADY BEEN CIRCULATED TO THE SHAREHOLDERS OF THE COMPANY AND ON AND FROM THE DATE HEREOF, THE AGM NOTICE SHALL ALWAYS BE READ IN CONJUNCTION WITH THIS CORRIGENDUM.

All other contents of the notice remain unchanged.

For Viaz Tyers Limited

sd/-

Hema Advani

Company Secretary

Date: 26/09/2025

Place: Ahmedabad